

પ્રાર્થના પ્રવચન કાર્યક્રમ



ડૉ. ડી. એમ. પટેલ
કન્વીનર

“પ્રાર્થના એટલે આત્માનો ખોરાક”

કોલેજમાં દિવસની શરૂઆત સામુહિક પ્રાર્થના કાર્યક્રમથી થાય. સમગ્ર વર્ષ દરમિયાન દરેક તાલીમાર્થીને તક મળે તે રીતે પ્રાર્થના, ગીત, પ્રવચન, પ્રતિજ્ઞાપત્ર, વંદેમાતરમથી કાર્યક્રમ દરરોજ ચાલે. સમગ્ર પ્રક્રિયા તાલીમના ભાગરૂપે થતી હોવાથી તેમને કૌશલ્ય વિકસાવવાની તક મળે.

પ્રાર્થના પ્રવચનના હેતુઓ :-

૧. પ્રશિક્ષણાર્થીઓનું તન અને મનથી પ્રભુ તરફ વળે.
૨. પ્રશિક્ષણાર્થીઓના ગાન કૌશલ્યોનો વિકાસ થાય.
૩. પ્રશિક્ષણાર્થીઓનું વિવિધ વિષયો પર પ્રેરણાદાયી વિચારો રજૂ કરતા થાય.
૪. પ્રશિક્ષણાર્થીઓ મનનીય વક્તવ્ય માટેના પુસ્તક વાંચતા થાય.
૫. પ્રશિક્ષણાર્થીઓની મૌખિક અભિવ્યક્તિનો વિકાસ થાય.
૬. પ્રશિક્ષણાર્થીઓ એકબીજા માટેની સહકાર અને સમજણની ભાવનાનો વિકાસ થાય.
૭. પ્રશિક્ષણાર્થીઓમાં સ્વતંત્ર અભિવ્યક્તિ માટેનો આત્મવિકાસ થાય.

પ્રશિક્ષણાર્થીઓની સાથે સાથે અધ્યાપકો પણ પ્રાર્થના પ્રવચન કાર્યક્રમ અંતર્ગત દર ગુરૂવારે વિવિધ ગીતો અને વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરતા હતા.

વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન અધ્યાપકોએ વ્યક્ત કરેલા વિચારોના/વિષયોની યાદી

ક્રમ	નામ	વિષય
૧	ડૉ. ડી. આર. પરમાર	વાર્તા - ગુલદસ્તો, તમારી પેરાશૂટ કોણ પેક કરે છે?
૨	ડૉ. પી. કે. યાજ્ઞિક	TIME MANAGEMENT, સફળતા
૩	ડૉ. ડી. એમ. પટેલ	વિશ્વ માનવ અધિકાર દિવસ
૪	ડૉ. એમ. આર. સોલંકી	એ.પી.જે. અબ્દુલ કલામના મતે શિક્ષક, ગીતા જયંતી
૫	ડૉ. બી. આર. મિસ્ત્રી	ક્રોધ (પુસ્તક સમીક્ષા)
૬	ડૉ. એમ. એચ. રાઠોડ	કર્મનું ફળ
૭	ડૉ. રાજેશ ભટ્ટ	ભારતનું બંધારણ
૮	ડૉ. એસ. બી. ખેર	હકારાત્મક અભિગમ
૯	ડૉ. વી. એલ. ભાવસાર	વાંચન ખોલે વિશ્વ બારી